



સર્વિસ રિક્વેસ્ટ નં.

કોર્પોરેટ સીઆરએન

--	--	--	--	--	--	--	--

રોકાણ એકાઉન્ટ નં.

હું/અમે

ગ્રાહક દ્વારા ઘોષણા:

(કૃપા કરી સંબંધિત વિકલ્પ પર ટિક કરો)

સેન્ટ્રલ કેપાયસી રજિસ્ટ્રી (સીકેપાયસીઆર) માંથી કેપાયસી દસ્તાવેજો ડાઉનલોડ કરવાની સંમતિ

હું માર સીકિયાયસી રજિસ્ટ્રીના ડેટાબેઝમાંથી મારી ઓળખ અને સરનામાની ચકાસણી કરવા અને બેંકના રેકૉર્ડમાં તેને અપડેટ કરવા માટે સેન્ટ્રલ કેપાયસી રજિસ્ટ્રી (સીકિયાયસીઆર) માંથી મારા કેપાયસી રેકૉર્ડ્સ ડાઉનલોડ કરવા માટેની મારી સંમતિ આપું છું. હું સમજું છું કે મારા કેપાયસી રેકૉર્ડમાં મારી વ્યક્તિગત માહિતી જેવી કે મારું નામ, સરનામું, જન્મ તારીખ, પીએએન નંબર, વગેરેનો સમાવેશ થાય છે. જો સીકિયાયસીઆર ડેટાબેઝમાં ઉપલબ્ધ દસ્તાવેજો વાંચી શકાતા ન હોય અથવા બેંકની હાલની કેપાયસી નીતિ સાથે સુસંગત ન હોય અથવા આરબીઆઈના કેપાયસી અંગેના મુખ્ય દિશાનિર્દેશ (સમય-સમય પર સુધારવામાં આવેલ) માં ઉલ્લેખિત અન્ય કોઈપણ કારણોસર, હું નવા કેપાયસી દસ્તાવેજો સબમિટ કરવા માટે સંમત છું.

☐ સીકેવાયસીઆર રિપોઝીટરી ડેટા ચેક વિના વિનંતીની પ્રક્રિયા માટે ઘોષણા

હું એકાઉન્ટ ખોલવા/જાળવાણી/કેવાયસી હેતુ/અન્ય કાઈપણ બેંકિંગ સેવાઓ માટે મારા કેવાયસી દસ્તાવેજો સ્વેચ્છાએ શેર કરી રહ્યો છું અને આથી કોટક મહિન્દ્રા બેંકને સહિવાયસીઆર રિપોઝીટરી ડેટા ચેક વિના વિનંતી પર પ્રક્રિયા કરવા માટે અધિકૃત કરું છું.

નીચે આપેલી વિગતો મુજબ તમારો રેકૉર્ડ અપડેટ કરવા માટે તમને વિનંતી કરીએ છીએ.

અપડેટ કરવું

જન્મ તારીખ ટિ ટિ મ મ વ વ વ વ **પાસપોર્ટ નંબર** **એક્સપાયરી ડેટ**

સરનામામાં ફેરફાર

વ્યક્તિગત ગ્રાહક ☐ ટપાલનું સરનામું ☐ કાયમી સરનામું

ઓફિસ/ભારતીય (એનઆરઆઈ/પીઆઈઓ ના કિસ્સામાં) સરનામું. કૃપા કરીને નીચેના વિકલ્પો પસંદ કરો

જો તમારું ઓફિસનું સરનામું અને તમારું ટપાલનું સરનામું એક જ હોય, તો કૃપા કરીને ટિક કરો (જ્યાં તમામ સંદેશાવ્યવહાર મોકલવામાં આવશે)

☐ સીઆરએન સ્તરે કરવામાં આવનાર ફેરફાર (એટલે કે બેંક સાથેના તમામ સંબંધો માટે) ☐ ઉપર ઉદ્દેશ કરવામાં આવેલા એકાઉન્ટના સ્તરે કરવાનો ફેરફાર

રહેઠાણ/વિદેશમાં (એનઆરઆઈ/પીઆઈઓ ના કિસ્સામાં) સરનામું/રજિસ્ટર્ડ સરનામું

જો તમારું રહેઠાણનું સરનામું અને તમારું ટપાલનું સરનામું એક જ હોય, તો કૃપા કરીને ટિક કરો (જ્યાં તમામ સંદેશાવ્યવહાર મોકલવામાં આવશે)

☐ સીઆરએન સ્તરે કરવામાં આવનાર ફેરફાર (એટલે કે બેંક સાથેના તમામ સંબંધો માટે) ☐ ઉપર ઉદ્દેશ કરવામાં આવેલા એકાઉન્ટના સ્તરે કરવાનો ફેરફાર

બિન-વ્યક્તિગત ગ્રાહક

સીઆરએન સ્તરે કરવામાં આવનાર ફેરફાર (એટલે કે બેંક સાથેના તમામ સંબંધો માટે)

☐ માત્ર ઉપર ઉલ્લેખ કરવામાં આવેલા એકાઉન્ટમાં કરવાનો ફેરફાર

☐ તમામ એચએસ સ્તરે સરનામાંમાં ફેરફાર ☐ સરનામાંમાં ફેરફાર માત્ર ચોક્કસ એચએસ પર લાગુ કરવા માટે

જેમને માટે સરનામામાં ફેરફાર લાગુ પડશે તેવા એયુએસ ના સીઆરએન ની સુધિ ('સરનામામાં ફેરફાર માત્ર ચોક્કસ એયુએસ પર લાગુ' પડતો હોય તેવા કિસ્સામાં લાગુ પડે છે)

--	--	--	--	--	--	--	--

--	--	--	--	--	--	--	--

☐ સંચાલનનો પ્રકાર ☐ એક વ્યક્તિ દ્વારા ☐ કોઈપણ/હયાત ☐ સંયુક્ત રીતે ☐ કોઈપણ એક/હયાત

<input type="checkbox"/> મોબાઈલ નંબર	આઈમેસડી કોડ	<input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/>	<input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/>	<input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/>	<input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/>
<input type="checkbox"/> ઇમિઇલ એડ્રેસ					
કૃપા કરીને મોબાઈલ નંબર/ ઈ-મેઈલ આઈડી માં ફેરફાર જરૂરી હોય તેવા કિસ્સામાં સાધન ધન કરો					
<input type="checkbox"/> પેન માં સુધારો કરો					
<input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/> <input type="text"/>					

ગ્રાહકની સહી
 (વ્યક્તિ ન હોય તેવા કિસ્સામાં, કૃપા કરીને સહી,
 સંસ્થાના સિક્કા સાથે નામ અને હોદ્દો આપો)

☐ નેટ બેન્કિંગ અને ગ્રાહકને વિતરણયોગ્ય તમામ માહિતી પર નોમિનેઈંગ દર્શાવો
☐ હા
☐ ના

☐ જન્મ તારીખ સુધારવાની વિનંતી (ઉંમરનો માન્ય પુરાવો આપો)

દિ

દિ

મ

મ

વ

વ

વ

વ

માત્ર ડિમેટ એકાઉન્ટને લગતી વિનંતી:
☐ ડિવિડન્ડ એકાઉન્ટ
☐ ડિમેટ ચાર્જિસ

બેંકનું નામ:

બ્રાંચનું નામ અને સરનામું:

ફોટો નંબર / બિલ્ડીંગ

વિસ્તાર

શહેર

પિન્ કોડ

રાજ્ય

શેરી/પ્લોટ

નિશાની

દેશ

☐ એકાઉન્ટ નંબર:

☐ એમઆઈસીઆર નંબર:

☐ પેન નંબર અપડેટ કરવાની વિનંતી:

☐ આધાર અપડેટ કરવાની વિનંતી:

[illegible]

ભાત્ર બેંકના ઉપયોગ માટે

એકત્રિત કરવામાં આવેલ અધિકૃત રીતે માન્ય દસ્તાવેજ (ઓવીડી): ☐ આધાર (બેંક દ્વારા ઈ-કેવાયસી પ્રમાણીકરણ પછી) ☐ પાસપોર્ટ ☐ ડ્રાઇવિંગ લાયસન્સ
☐ મતદાર ઓળખપત્ર ☐ અન્ય _____

ઓવીડી નંબર:

સ્વીકૃતિની તારીખ <input type="text"/><input type="text"/> <input type="text"/><input type="text"/> <input type="text"/><input type="text"/> <input type="text"/><input type="text"/> <input type="text"/><input type="text"/>

સહીની ચકાસણી કરનાર

પ્રાસકર્તાનો સિક્કો

આ તારીખે દસ્તાવેજો સીપીસી/આરપીસી પર મોકલવામાં આવ્યા અધિકૃત કરનાર

ધોષણા:
 હું/અમે આથી મારા/અમારા દ્વારા ચૂકવવાપાત્ર તમામ પ્રકારના લાગુ પડતા બેંક ચાર્જિસ/સર્વિસ ચાર્જિસ ઉપરોક્ત એકાઉન્ટમાંથી ડેબિટ કરવા માટે બેંકને અધિકૃત કરીએ છીએ. હું/અમે બાંધધરી આપીએ છીએ કે લાગુ પડતા સર્વિસ ચાર્જને ડેબિટ કરવાની સુવિધા માટે ઉપરોક્ત એકાઉન્ટમાં પર્યાપ્ત બેલેન્સ જાળવવામાં આવશે. ઉપરોક્ત એકાઉન્ટમાં પર્યાપ્ત બેલેન્સ જાળવવાની મારી/અમારા તરફથી નિષ્ફળતા કોઈપણ રીતે બેંકના સર્વિસ ચાર્જિસ ડેબિટ કરવાના અધિકારને નુકસાન પહોંચાડશે નહીં. હું/અમે આથી લાગુ પડતા સર્વિસ ચાર્જિસ ડેબિટ કરવાને કારણે ઉપરોક્ત એકાઉન્ટમાં ડેબિટ બેલેન્સ પર કોઈપણ વ્યાજ ચાર્જ કરવા માટે બેંકને વધુ અધિકૃત કરીએ છીએ. બેંક ઉપરોક્ત એકાઉન્ટ પર ઓવરડ્રાફ્ટ સુવિધા આપવા માટે બંધાયેલ નથી પરંતુ અમારા/મારા દ્વારા ચૂકવવાપાત્ર લાગુ પડતા સર્વિસ ચાર્જિસ ડેબિટ કરશે. હું/અમે ખાસ કરીને સંમત છીએ અને પુષ્ટિ કરીએ છીએ કે અહીં નીચે ઊભી થતી કોઈપણ બાબત અથવા મુદ્દો એકમાત્ર ભારતીય કાયદાઓ અનુસાર સંચાલિત અને નિર્માણ કરવાનો રહેશે અને તે ભારતમાં મુંબઈની અદાલતોના અધિકારક્ષેત્રને આધીન રહેશે. હું/અમે એલટી મેળવવા માટે બેંકને આપેલા મોબાઈલ નંબર/ઈ-મેઈલ આઈડી પર એલટી ન મળવાના કિસ્સામાં બેંકને જાણ કરવાની પણ જવાબદારી લઈએ છીએ. હું/અમે સંમત છીએ કે મારા/અમારા એકાઉન્ટ/સમાં છેતરપિંડીયુક્ત વ્યવહારના કિસ્સામાં વ્યવહાર સંબંધિત એલટી ન મળે તો તેને માટે બેંકને જવાબદાર હેરવવામાં આવશે નહીં. હું/અમે સંમત છીએ કે મારા એકાઉન્ટમાં મોબાઈલ નંબર ફોન નંબર અપડેટ ન થવાના કિસ્સામાં બેંક એકાઉન્ટમાં ઇલેક્ટ્રોનિક વ્યવહારો (દા.ત. એનબી, ઈ-કોમર્સ, પીઓએસ) વગેરે પ્રતિબંધિત કરશે અને મારા એટીએમ પર રોકડ ઉપાડવાની મંજૂરી આપશે. મેં ઉપરોક્ત માહિતી સ્વેચ્છાએ પૂરી પાડી છે જે હું સ્વીકારું છું કે મને તેના ઉત્પાદનો અને સેવાઓ પૂરી પાડવા માટે બેંક મેળવવી જરૂરી છે. મેં બેંક દ્વારા તેની વેબસાઈટ www.kotak.bank.in પર પ્રકાશિત કરવામાં આવેલી ગોપનીયતા નોટિસ વાંચી છે અને હું તેને માટે સંમત થાઉં છું. હું બેંકમાંથી વિવિધ ઉત્પાદનો અને સેવાઓનો લાભ લઉં ત્યારે ગોપનીયતા સૂચનામાં આપેલ હેતુઓ માટે અને તે રીતે મારી વ્યક્તિગત માહિતી પર પ્રક્રિયા કરવા માટે હું આથી બેંકની તરફેણમાં મારી સંમતિ આપું છું.

તારીખ:

દિ

દિ

મ

મ

વ

વ

વ

વ

સહી(ઓ)

૧લા એકાઉન્ટ ધારક
(વ્યક્તિ ન હોય તેવા કિસ્સામાં, કૃપા કરીને સહી, સંસ્થાના સિક્કા સાથે નામ અને હોદ્દો આપો)

૨જા એકાઉન્ટ ધારક
(વ્યક્તિ ન હોય તેવા કિસ્સામાં, કૃપા કરીને સહી, સંસ્થાના સિક્કા સાથે નામ અને હોદ્દો આપો)

૩જા એકાઉન્ટ ધારક
(વ્યક્તિ ન હોય તેવા કિસ્સામાં, કૃપા કરીને સહી, સંસ્થાના સિક્કા સાથે નામ અને હોદ્દો આપો)

૪થા એકાઉન્ટ ધારક
(વ્યક્તિ ન હોય તેવા કિસ્સામાં, કૃપા કરીને સહી, સંસ્થાના સિક્કા સાથે નામ અને હોદ્દો આપો)

મહત્વપૂર્ણ નોંધો:

(વ્યક્તિ માટે – એકાઉન્ટ સ્તરના ફેરફારો માટે તમામ એકાઉન્ટ ધારકોએ સહી કરવાની જરૂર છે જ્યારે સીઆરએન સ્તરના ફેરફારો માટે સંબંધિત સીઆરએન ધારકે સહી કરવાની રહેશે, બિન-વ્યક્તિગત માટે એમઓપી મુજબ સહી જરૂરી છે.)

કૃપા કરી નોંધ લેશો:

*સુધારેલા પેન કાર્ડ સાથે ગેઝેટ નોટિફિકેશનની નકલ સાથે રાખવી. જો નામમાં ફેરફાર લગ્નને કારણે હોય, તો સુધારેલા ડ્રાઇવ કાર્ડ સાથે લગ્નના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ સબમિટ કરવી આવશ્યક છે (માત્ર સીએએસએ એકાઉન્ટ્સ માટે લાગુ).

- સરનામામાં ફેરફાર માટે, કૃપા કરીને પાસપોર્ટ/ડ્રાઇવિંગ લાયસન્સ/ચૂંટણી કાર્ડ/વીજળી બિલ અથવા લેન્ડલાઇન ટેલિફોન બિલની નકલ સબમિટ કરીને નવા સરનામાનો પુરાવો (સ્વયં પ્રમાણિત) આપો, જે ૩ મહિનાથી વધારે જુનો ન હોવો જોઈએ (માત્ર ડિમેટ માટે) અને કેવાયસી ગ્રીડ મુજબ સીએએસએ માટે. ઉપરાંત ડિમેટ એકાઉન્ટ માટે સરનામામાં ફેરફારની વિનંતી માટે પણ કૃપા કરીને માન્ય ઓળખનો પુરાવો અને નવા સરનામાના પુરાવા સાથે નવીનતમ ડીપી ટ્રાન્ઝક્શન સ્ટેટમેન્ટની નકલ આપો.
- પેન નંબર અપડેટ કરવા માટે, કૃપા કરીને પેન કાર્ડની મૂળ નકલ આપો.
- ડિમેટ એકાઉન્ટના કિસ્સામાં બેંકની વિગતોમાં ફેરફાર માટે; નવી બેંક વિગતોનો પુરાવો સબમિટ કરવો જરૂરી છે (બેંક સ્ટેટમેન્ટની પ્રમાણિત નકલ અથવા ચેકની નકલ)
- કૃપા કરીને અલગ-અલગ ક્લાયન્ટ આઈડી માટે અલગ વિનંતીઓ સબમિટ કરો (માત્ર ડિમેટ માટે)
- ડિમેટ સંબંધિત વિનંતીઓ માટે, ફોર્મ પર તમામ એકાઉન્ટ ધારકો (વ્યક્તિઓ માટે) અને નોંધાવી કરવામાં આવી હોય તે મુજબ અધિકૃત સહીર્તાઓ દ્વારા (બિન-વ્યક્તિઓ માટે) દ્વારા સહી કરવી આવશ્યક છે.
- મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણના કિસ્સામાં, તમામ એએમસી માં સરનામામાં ફેરફાર અને સંપર્ક વિગતોમાં ફેરફારને અસર આપવા માટે કેઆરએ (કેવાયસી રજિસ્ટ્રેશન એજન્સી) ને “વ્યક્તિઓ/બિન-વ્યક્તિઓ માટે કેવાયસી ની વિગતોમાં ફેરફાર ફોર્મ” સબમિટ કરો. સંબંધિત એએમસી/કેઆરએ સાઈટ્સ પર ફોર્મ ઉપલબ્ધ છે.
- મ્યુચ્યુઅલ ફંડના કિસ્સામાં, સંચાલનની પદ્ધતિમાં કોઈપણ ફેરફાર માટે, નામ, સહી અને બેંકની વિગતોમાં ફેરફાર માટે, ગ્રાહકે દરેક એએમસી (ફોલિયો મુજબ) માટે બેંક અથવા સીદા એએમસી ને અલગથી વિનંતી કરવાની રહેશે. લગ્નને કારણે નામમાં ફેરફારના કિસ્સામાં લગ્નના પ્રમાણપત્રની નોટરાઈઝ્ડ નકલ, નવા નામ સાથેનું પેન કાર્ડ અને રોકાણકારની બેંક દ્વારા પ્રમાણિત જૂની અને નવી સહી, જો બદલાયેલ હોય તો, જરૂરી છે.
- મોબાઈલ/ઈ-મેઈલ આઈડી માં ફેરફાર માટે, કૃપા કરીને ઓળખનો પૂરાવો આપો.
- કૃપા કરીને નોંધ લેશો કે એકાઉન્ટ સ્તર પર સરનામામાં ફેરફાર માત્ર ત્યારે જ થશે જ્યારે તમે સંબંધિત એકાઉન્ટ નંબરનો ટોચ પર ઉલ્લેખ કર્યો હશે.

સ્વીકૃતિ પત્રોંચ

અમે શ્રી/શ્રીમતી/કુ._____ તરફથી ગ્રાહક ફેરફાર સૂચનાની સ્વીકૃતિ રસીદ આપીએ છીએ, ગ્રાહક સંબંધ નંબર સાથે સંબંધિત

સર્વિસ રિકવેસ્ટ નંબર _____ હેઠળ

તારીખ: _____

બેંક અધિકારી (સહી અને સિક્કો) _____

કોટક મહિન્દ્રા બેન્ક લિમિટેડ માટે

Kotak Mahindra Bank Ltd. CIN: L65110MH1985PLC038137

Registered Office: 27 BKC, C 27, G Block, Bandra Kurla Complex, Bandra (E), Mumbai - 400 051. www.kotak.bank.in